

અહિંકારની વિશ્વાસીઓનું પ્રાણી જીવનની આત્માનું હશે

## પુષ્ટિસમ્પ્રદાય અને સમયની સમૃદ્ધિ

અસિત શાહ

અહિંકારની વિશ્વાસીઓનું પ્રાણી જીવનની આત્માનું હશે

### ઉપકમ

૧. કેટલાક દાયકા પૂર્વો (જ્યારે મોબાઈલ ફોન કે ઈયરપોડ પ્રચલિત નહોતા ત્યારે) એક મિડિયા ગ્રુપે એક પ્રયોગ કર્યો. લંડનની ટ્યૂબ રેલવેના એક મેટ્રો સ્ટેશનની બહાર સ્ટેશન તરફ જવાના રસાયર સવારના કામધંદે જવાના સમયે કોઈ આગોતરી પ્રસિદ્ધ કર્યા વિના એક સુપ્રસિદ્ધ પિયાનોવાદક પિયાનો વગાડવા લાગ્યો અને અનેક કેમેરાઓદારા આગંતુક લોકોની પ્રતિક્રિયા રેકૉર્ડ કરવામાં આવી. પછી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. મોટા ભાગે લોકો પિયાનોવાદન જાણે સાંભળતા જ ન હોય કે વાદકને જોતા જ ન હોય તેમ પસાર થઈ ગયા. જવલ્લે કેટલાક લોકો, ખાસ કરીને બાળકો અને વૃધ્યો, તેની નોંધ લઈ સાંભળી અને જોઈ રહ્યા. તે પૈકી કેટલાક થોડીવાર પછી જતા રહ્યા તો કેટલાક વાદનને માગુણતા ત્યાં જ થંભી ગયા.

પોતાના ‘સોશિયલ ઇન્ટેલિજન્સ’ નામક પુસ્તકમાં સુપ્રસિદ્ધ લેખક ડેનિયલ ગોલમાન આ પ્રયોગના આધારે એવા તારાગાપર આવે છે કે આધુનિક સમયમાં આપણી સંવેદના / સહાનુભૂતિ / માગુણસાઈ મરી પરવારી નથી, પણ જરૂરના કારાગે તે અપ્રકૃત રહે છે. ટ્રેન પકડવાની લાયકીમાં આજુજુ કરતો બિભારી કે ભૂષ્ણું-તરસ્યું જાનવર / બાળક કે ધાર્યાલ / અસ્વસ્થ પ્રવાસી ની નોંધ લીધા વગર લોકો સડસડાટ પસાર થઈ જાય છે, હાઈવેપર પૂર્પાટ દોડતી ગાડીની માફક. જો બાળકો કે વૃધ્યોની માફક થોડી જરૂર ઓછી હોય તો ઈન્સ્ટ્રિયોથી ગ્રહણ થાં રૂપ-રસ-ગન્ધ-સ્પર્શ-શબ્દ આપણી સંવેદનાના તારને પણ ચોક્કસ જાગુજાગાવે જ. આપણે કોઈક પ્રતિક્રિયા તો આપીએ જ, ભલે તે ઉપેક્ષાની પણ કેમ ન હોય.

સન ૧૯૯૮માં લખેલ પોતાની કાલ્પનિક લઘુનવલ ‘લા લેન્ટેઝર’ (=સ્લોનેસ) માં લેખક મિલાન કુન્ટેરા જુની પેઢીની સરખામાગીમાં નવી પેઢી આ જરૂરના દુષ્પાલાવ હેઠળ માનવસંબંધોને ટકાઉ અને યાદગાર બનાવવામાં કેવી રીતે નિષ્ણળ જાય છે તેનો તાદ્દશ ચિનતાર આપે છે.

૨. “કોઈ એક સમયે શ્રીગુરુલેશને ભણ કલ્યાણે વિનંતી કરીને પૂછ્યું કે મહારાજ, પ્રભુજીના દર્શન માંછે માંછે તથા વાતોમાંછે તથા સેવામાંછે થાય છે. ભગવદીય ભગવદ્વાર્તા-ચર્ચા કરે છે ત્યારે કોઈને

પૂર્ગરસનો અનુભવ થાય છે, કોઈને થોડા પાગ રસનો અનુભવ થાય છે, કોઈને થોડા પાગ રસનો અનુભવ થતો નથી. કોઈને વીરરસ પાગ થાય છે. તેનો ખુલાસો રાજ કૃપા કરીને કહો. ત્યારે શ્રીમુખે બોલ્યા કે લોકના ચિત્ત એક ભાંતિના નથી ; અનેક ભાંતિના છે. જેનાં જેવાં ચિત્ત તેને તેવો અનુભવ થાય છે. એક ચિત્ત આકાશ છે, એક ચિત્ત શૂન્ય છે ; તેને કોઈ વસ્તુ સ્પર્શ કરી શકે નહિ. બીજું ચિત્ત વજ છે ; તેને કોઈ વસ્તુ અડે ના તેમ કોઈ વસ્તુને ચિત્ત પાગ ન અડે. બીજું લોકું છે ; તે ચિત્તને કોઈ વસ્તુ ભેદી ન શકે પાગ અનિન્દે ભેદે. ચોણું ચિત્ત પથ્થર છે ; તે ચિત્તને ટાંકી ટાંકીને ભેદે, અનિન્દે ન ભેદે. પાંચમું ચિત્ત તે સોનું છે. જેકે કઠાગ છે પાગ અનિનો સંબંધ થાય તો માંહે સુંઘાળું પડે ને કોમળ થાય, સરસ થાય ; પછી કઠાગ જ રહે ને નીરસનું નીરસ રહે. તેમ કોઈના ચિત્ત સત્સંગમાં કોમળ થાય, પછી સત્સંગ હૂર થતાં કઠાગનું કઠાગ એટલે નીરસનું નીરસ રહે. છુંટું ચિત્ત તે લાખ ; થોડા અનિન્દે સરસ કોમળ થાય, પછી કઠાગનું કઠાગ રહે. સાતમું ચિત્ત તે મીણ ; તે સહજ કોમળ થાય છે, થોડી અનિન્દી સરસ કોમળ જ રહે. આઈમું ચિત્ત તે ધી છે ; એ સહજ કોમળ હોય છે, થોડી પાગ હાથની ગરમી હોય તો પાગ કોમળ થાય. તેમ ભગવદ્વાર્તાએ કોમળ થાય. એવું ચિત્ત ભગવન્દ્રપા વિના ન થાય. હવે નવમું ચિત્ત માખાગ છે. તે નિર્મળ અને ઊજળું છે, સ્નેહપૂર્વક સરસ અને કોમળ છે. કોઈ વખત કઠિનતાનો લેશ પાગ નથી. લૂંઝું નથી, મલિન નથી અને સુગંધિત છે. એવા ચિત્તમાં શ્રીગ્રભુજનો વાસ જાગુવો. ધીથી માખાગ સર્વોત્તમ છે. હવે દસમું ચિત્ત તે અમૃત. એના ગુગુ ઘાણા પ્રસિધ્ય છે ; ક્યાં સુધી કહીએ? પોતાના જે સંગી છે તેને અમર કરે તે ગુગુ પ્રસિધ્ય છે. પોતાના સંબંધી અધમ છે તેમને પોતાની બરાબર કરે છે એવા ચિત્ત છે. તેમને આધીન શ્રીગોકુલના પ્રભુ થઈને રહે છે. મુખ્ય ભક્ત તેમને જાગુણે કે જેમના તેવા ચિત્ત છે.” (શ્રીગોકુલનાથજીના હાસ્યવચનમૃત). અર્થ સ્વયં સ્પષ્ટ છે.

કવિ કલાપી કહે છે: “અરે! હદ્ય જે ગંધું રસ ગયો પછી તો બધો, ભલે મૂદુ રહી સહી જાખમ છેક ચૂરો થતું, કઠિન ન બનો કરી હદ્ય એ જ ઈચ્છનું પ્રભુ”.

“ એકવાર શ્રીપાતે પૂછ્યું કે મહારાજ, મન ચરણારવિદમાં શી રીતે રહે? ત્યારે આપે આજ્ઞા કરી કે સુરત કરી કરી ચિત્તમાં ય લાયે અને અભ્યાસ કરતો રહે તો આવે. જેમ કૂવાની પર પાપાગના થાળાને દોરીના કાપા પડે છે તેમ મનપર પાપ અભ્યાસથી અસર થાય છે. જો પદ્ધતરપર અભ્યાસથી ઘસારો પડે તો મનપર પાપ અભ્યાસથી ચરણારવિદની અસર કેમ ન પડે? ” ( શ્રીગોકુલનાથજીના હાસ્યવચનમૃત ). અર્થ સ્વયં સ્પષ્ટ છે.

બંને વાતને મેળવીને વિચારીએ તો આપણા સંપ્રદાયમાં પોતપોતાના ચિત્તાનુસાર ભગવદ્ભાવને વૃદ્ધિગંત કરવા સારુ સરખો સમય ફાળવવો આવશ્યક છે. ( સાર્વજનિક હવેલીમાં ભીડમાં ધક્કામુક્કી કરતાં અલપભલપ ક્ષાળિક દર્શન કરી લેવા માત્રથી કોઈ લાભ નથી થનો ). અનુયાયી પાસે ધન કે શારીરિક સમૃદ્ધિ ન યે હોય તો બધુ વાંધો ન આવે પાપ સમયની સમૃદ્ધિ જરૂરી છે.

હવે સમય તો સહુને ૨૪ કલાકનો સરખો જ મળેલ છે ; તેમાં કોઈ ગરીબ કે ધનવાન નથી. તો વિચારવાનું એ કે તેને કેવી રીતે ભચાવવો અને ફાળવવો જેથી કરીને ભગવદ્ભાવ વધે ?

નથી સમયની સમૃદ્ધિ = ટાઈમ રીચનેસ બાબતે આધુનિક વિચારકોનું શું મનત્ય છે અને મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યચરણના ઉપદેશોમાં તથા ભગવદીયોના ચરિત્રોમાં તેને સમાંતર અને તે ઉપરાંત શું પ્રાપ્ત થાય છે તે જાગ્રવું હિતકારક છે. તદ્વારાંત પ્રભુપ્રતિ સંવેદના જળવાઈ રહે તે માટે શું કરવું ને શું નહીં તે પાપ જાગ્રવું રહ્યું. ( આધુનિક વિચારકોનું મનત્ય જાગ્રવવાનો આશય અહીં ઉપદેશોને સમજવામાં તેઓ ઉપકારક થાય તેટલો જ છે ; ઉપદેશો કોઈને ગળે ઉત્તરે કે ન ઉત્તરે તેની દરકાર નથી ).

જે આ મામલે ગાફેલ રહેવા માંગતા હોય તે આગળ ન વાંચે.

## ટાઈમ રીચનેસનો પણ્યમમાં વિચાર અને તેના નુસખા

કેટલાક આધુનિક પણ્યમી વિચારકોના મતે સમયની સમૃદ્ધિ જ સાચી સમૃદ્ધિ છે. જે કોઈ વજન અને ધનવાન માલિક છે પાણ પોતે ઈચ્છે છતાં પોતાને ગમતા પરિવાર / શોખ / પરોપકારી પ્રવૃત્તિ આદિ પાછળ પોતાના સમય-પૈસા-શક્તિ નથી ફૂણવી શકતો તો તે ધનવાન નથી.

કહેવાય છે કે બાળપણમાં સમય અને શક્તિ હોય છે પાણ ધન નથી હોતું, યુવાનીમાં ધન અને શક્તિ હોય છે પાણ સમય નથી હોતો તો ઘરપણમાં ધન અને સમય હોય છે પાણ શક્તિ નથી હોતી. તેથી ખાસ કરીને યુવાનીમાં સમયની સમૃદ્ધિ ટકાવવી એક પડકાર છે ને કિમતી જાગુસ પાણ.

સ્વીવ ગ્લેવેસ્કી આ સમયની સમૃદ્ધિ વધારવા જમેલા ધંધો કરનારાઓ માટે આઈ નુસખા બતાવે છે. “પીડોટસ” ( પી-ઈ-એ-સી-ઓ-એ-ટી-એસ ) એ તેને યાદ રાખવાનું સૂત્ર બતાવે છે. અહીં તેનો અક્ષરશ: અનુવાદ ન કરતાં સારાંશ રજુ કરું છું.

(૧) પ્રાયોરિટાઈડ. અગ્રનાકમ ઠરાવો. એક સેલ્સ મેનેજરને તેના ગ્રાહકોનું મૂલ્યાંકન કરતાં જાગ્યાય કે ૨૦ ટકા ગ્રાહકો ૮૦ ટકા ધંધો આપે છે તો તેણે ને ૨૦ ટકા ગ્રાહકોપર પોતે વધુ સમય ને ધ્યાન આપી બાકીના ૮૦ ટકાને બહુ મહત્વ ન આપવું જોઈએ.

(૨) ઈકોનોમી ઓફ સ્કેલ. જે ક્રોશલ્ય-સંપર્કો-ગ્રાહકો-માળખું-સંગઠન તમારી પાસે ઉપલબ્ધ છે તેને જ નવા સાહસમાં વાપરો તો જરૂરી વિકાસ કરી શકો. તમારો ચાનો જમેલો ધંધો હોય અને કોઝીના ધંધામાં પડવું હોય તો નવેસરથી એકદે એકથી ચાલુ ન કરતાં ચાના ઉત્પાદન-વેચાણના માળખાને જ કોઝીમાટે પાણ ઉપયોગમાં લો.

(૩) એલાઈન. તમે એવા નવા ધંધા કરો જે જુના જમેલા ધંધા સાથે સંકળાયેલા હોય. જેમકે એક ખેલાડી નિવૃત થઈ પ્રશિક્ષક-કોચ કે ટીમનો પસંગીકાર-સિલેક્ટર કે મેનેજર કે બોર્ડનો પદાધિકારી કે કોમેન્ટેર બને તો તેમાં સેટ થવામાં ઓછો સમય લાગે. પાણ તે જો ચશ્માની દુંકાન ખોલે તો સમય અને જોખમ વધુ લાગે.

(૪) કટ વેસ્ટ. નકામી પ્રવૃત્તિઓ પર કાપ મૂકો. જે પ્રવૃત્તિઓ-ઉત્પાદનો-

ગ્રાહકો ખર્ચ વધારે કરાવી સામે રળાવતા ઓછું હોય તેને ઘટાડો કે બંધ કરો. જેમ કે ડુબર મળવાથી ફાપદો ન થતો હોય તો ફોન કરીને કે મેસેજ કરીને હાજરી નોંધાવતા રહો.

(૫) આઉટસોર્સ. બીજાને સોધો. જે કામ કરવાની ક્ષમતા તમારા કરતાં બીજાઓમાં સારી હોય તેને બીજાઓથી કરાવો. તમારી ક્ષમતા તેની યોગ્ય દિશામાં વાપરો. જેમ કે વીમાની કંપની ઈન્સ્યુરન્સ એજન્ટોને રાખો.

(૬) ઓટોમેટ. બની શકે તેને ઓટોમેટિક = આપોઆપ થાય તેવું કરો. જેમ કે કેટલાક દેશો વિદેશી પ્રવાસીને ઉત્તરતાંવેત વીસા મળી જય તેવો પ્રબંધ- વીસા ઓન અરાઇવલ- કરે છે તો પ્રવાસીઓને તે સહેલું પડે છે.

(૭) ટેસ્ટ. દરાવેલ સમયાંતરે પ્રવૃત્તિની દિશા યકાસતા રહો, જેથી ખોટી દિશામાં બહુ આગળ ન વધી જાઓ. નહીં તો બે-ગાળો સમય લાગી શકે.

(૮) સ્ટાર્ટ યોર એન્જિન. આરંભિક પ્રવૃત્તિ નિર્ધારિત કરો. જેમ કે રોન્ડિંગ કામની શરૂઆત એક સ્નાન કે ચાની ચૂસકી કે એક ઊંઘનું જોકું કે ક્ષાળિક સંગીતશ્રવણ કે ધ્યાન કે સૂર્યદર્શન કે એક લટાર માર્યા પછી કરો. ધીરે ધીરે આમ કરતાં એક શિસ્ત આવે છે.

## પુષ્ટિસમ્પ્રદાયમાં સમયની સમૃદ્ધિનો ઉપદેશ

આને સમાંતર શ્રીઆચાર્યરાગના ઉપદેશોમાં શું કહેલ છે તે હવે કુમશઃ જોઈએ. તેમાં એ તકેદારી ખાસ રાખી છે કે સમયની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા જતાં સંવેદના = ભગવદ્ભાવ ન ખોઈ બેસીએ. કેમકે આપાગો પ્રોજેક્ટ ભગવદ્ભાવની વૃદ્ધિનો છે ; તેમાં સમય વપરાયો તે તો લેખે લાગ્યો ગાળાયે.

### (૧) પ્રાયોરિટેઇઝ

જીવનમાં આપાગા ન્યિલિધ કર્તવ્યો પૈકી સહુ પ્રથમ વૈખુગન કર્તવ્યો, ત્યાર બાદ વૈદિક કર્તવ્યો અને લૌકિક કર્તવ્યો — એવો અગ્રતાકુમ શ્રીઆચાર્યરાગે પુષ્ટિપ્રવાહમર્યાદા ગ્રંથમાં ઉપદેશેલ છે : “ લૌકિકત્વં વૈદિકત્વં

કાપવ્યાત તેણું ન અન્યથા, વૈષ્ણગવત્સં હિ સહજમ્". ત્રાગે ય કરવાના છે, પાણ મહત્ત્વ વૈષ્ણગવ કર્તવ્યોને આપ્યું છે. સંતુલન જળવાય ત્યાં સુધી ત્રાગે ય કરતા રહેવા, પાણ ક્યારેક ટકરાવ થાય તો વૈષ્ણગવ કર્તવ્યોના ભોગે લૌકિક-વૈદિક કર્તવ્યોને ન નિભાવવા. સેવા-કથાના અનવસરમાં જીવિકાનું ઉપાર્જન પાણ કરવું અને સામાન્યધર્માચારાણ પાણ કરવું. ભક્તિમાર્ગી બન્યા એટલે હાથપર હાથ ધરી બેસી જવાનું નથી. પરન્તુ કમાવામાં એટલા ખૂંપી પાણ નથી જવાનું કે ભક્તિ કરવા સમય જ ન હેઠ હાથમાં. છેતરવાનું ત્રાગેયમાં કોઈને નથી કહેલ, પાણ કપટથી- એટલે કે વેઠ ઉતારતાં હોઈએ તેમ કર્મને- કરો તો લૌકિક-વૈદિક કર્તવ્યોને કરો ; ભક્તિને તો સહજતાથી કરો.

કેટલાક જુવાનિયા એમ કહેતા હોય છે કે સરખું કર્માઈને ઘરભેગું કરી લઈએ પછી ક્રોદ્ધબિક જવાબદારીઓ પાર પાડ્યા બાદ ઘડપાણમાં ભજન કરશું. પરન્તુ તેઓ એમ નથી કહેતા કે ૪૦-૪૨ વર્ષે સેટલ થઈને પછી લગ્ન કરશું! તે તો જુવાનીમાં જ કરીને પડશે તેવા દેવાશો એવો અભિગમ ધરાવતા હોય છે! તો પછી ભક્તિને શામાદે ઘડપાણની અભરાઈપર ચઢાવવી જોઈએ? "યદિ શ્રીગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હદિ, તતઃ તિમ્ અપરં ખૂંપિ લૌકિકે: વૈદિકે: અપિ!".

### (૨), (૩) ઈકોનોમી ઓફ સ્કેલ, એલાઈન

તત્ત્વાર્થીપનિબંધના ભક્તિપ્રકરાણમાં શ્રીઆચાર્યચારાણ સૂત્રદ્રો એક ઉપદેશ આપે છે "યથાલધોપચારકે: ". જે ઉપલબ્ધ છે તેનાથી ભજન કરો. એક ગૃહસ્થ પાસે ઘર-પરિવાર-ધન-સ્નાન તેમ જ રસોઈ આદિની સગવડ વગેરે હોવાના જ. તો હોય તેટલાથી ભગવત્સેવા શરૂ કરી દેવી. આ પ્રકરાણમાં મોટે ભાગે ગૃહસ્થને અનુલક્ષીને સેવોપદેશ છે. પછી આપશ્રી આજ્ઞા કરે છે કે ભક્તિયારી વ્યક્તિ પાસે ઘર અને નોકરચાકર હોય તો તે પાણ ગૃહસ્થની માફિક સેવાપ્રકાર નિભાવી શકે છે. કોઈ પહેલેથી જ ભ્રમાણ કરતો સંન્યાસી હોય તો તેને તીર્થાટનના દ્રોપે ભજન કરવાનો આપશ્રી ત્યારબાદ ઉપદેશ આપે છે.

આશ્રમની માફિક જ વાર્ણનું સમજવું. ભ્રાત્રાણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર એ પોતપોતાની રીતે અનિષિદ્ધ પ્રકારે આજીવિકા રળવાની ચાલુ રાખવાની છે.

ગૃહસેવામાં ય પુત્ર-પત્ની વગેરે અનુકૂલ હોય તો તેમને ય સેવામાં સામેલ કરવા અને ઉદાસીન હોય તો પોતે ઓક્લાબે સેવા કરવી. ધનિક છો તો વૈભવથી સેવા કરો અને નથી તો જ્યારે જે મળ્યું તેનાથી નિર્વહિ કરો સેવાનો. રસોઈ આવડતી હોય તો સામગ્રીઓ કરો ને ગાતા આવડતું હોય તો કીર્તનો ગાઓ. રોજબરોજનું સ્થાનિક બજારમાં મળતું હોય તે ત્યાંથી ખરીદો ને ક્યારેક જોઈતું બહારગામથી મંગાવી શકતું હોય તે બહારગામથી મંગાવો.

કેટલાક લોકો એમ કહેતા હોય છે કે સમ્પ્રદાયમાં એક સંસ્થા કે સંગઠન ઊભા કરવા જોઈએ, જે બધાને બધું સમયસર સત્તામાં સારી ગુગુવત્તાનું ઉપલબ્ધ કરાવે. પરન્તુ આવા સંગઠનને ઊભું કરવામાં ખાસ્સો સમય ને કાર્યકર્તાઓ લાગે. તેમાં સભ્યો હોવાના ને મેમ્બરશીપની ફી હોવાની ને પોતાના-પારકા પદાધિકારીઓ હોવાના ને વાડી-ઓફિસ હોવાની ને ચુંટાગી હોવાની ને રાજકારણ હોવાનું ને ઘરભેગું કરી જનારા લેભાગુ પાગ હોવાના ! તેના કરતાં દરેક વ્યક્તિ પોતે આત્મનિર્ભર બને તેમાં સમયની બચત છે ને હૈયાવરણની પાગ. શ્રીઆચાર્યચરાગું ગુરુ તરીકે તેથી જ કોઈ સંગઠન બનાવવું જરૂરી ન સમજ્યું, સિવાય કે સેવ્ય-સેવકનું, જે ઝટપટ બની ગયું ને કારગર નીવડ્યું.

તો બીજા સમ્પ્રદાયોની માફક આપાગે ત્યાં ઘરભાર છોડી કામધ્યા છોડી ગામ છોડી કાયમ માટે આશ્રમમાં સ્થળાન્તરિત થવાની કોઈ યોજના નથી. સાધના તે બધું કાયમ રાખીને ઝડપથી શરૂ કરી દઈ શકાય છે. શ્રીઆચાર્યચરાગુંની નીતિ મુજબ જો ઘડાને પકાવીને પાણી ભરવા ઉપયોગમાં લઈ શકતો હોય તો તેને ફોડી નાખવાની જરૂર નથી ; સંસ્કાર કરો, ત્યાગ નહીં.

#### (૪) કૃત વેસ્ટ

એક મેરેજબ્યુરોમાં ચાર જગ્યા સંચાલક પાસે પહોંચી ગયા. એકે શરૂ કર્યું— “હું બિજનેસમેન છું. મારી દુનિયાના અનેક ખંડોમાં અનેક ઓફિસો છે અને ત્યાંના સ્થાનિક ગ્રાહકો સતત મારા સંપર્કમાં રહે છે. હું દિવસ-રાત મહેનત કરી તેને સંભાળું છું.” બીજાએ કહ્યું— “હું એમ.એન.સીમાં નોકરી કરું છું ને ઓવરટાઇમ તથા રજાના દિવસે ય કામ કરું છું.” ત્રીજાએ કહ્યું— “હું નોકરીના કામે મહિને ૧૫-૨૦ દિવસ બહારગામ જતો હોઉં છું.” ચોથાએ કહ્યું— “હું દસ બાય

દસ ફૂટની ઓરીમાં રહું છું.” પછી ચારેય ભેગા મળી બોલ્યા કે શું તમારું મેરેજબુરો અમારે માટે કન્યા શોધી આપશો? સંચાલકે કહું— “તમે કોઈ લગ્નોત્સુક નથી. તમે કાં તો ખોટા ઠેકાણો આવી ગયા છો કે પછી અમારા બ્યુરોની સફળતા ન જરવાતાં ટીઝણ કે અપપ્રચાર કરવા ચાડો છો. અમારું બ્યુરો જે લગ્નોત્સુક ન હોય તેને માટે નથી ને તેમાં અમને કોઈ નાનમ નથી લાગતી. હવે રવાના થાઓ.” આવા બની બેઠેલા મુરતિયા (ક્યારેક તો વૃધ્ય હોય છે!) આપણે તાં પાગ ભરી સભામાં કે ઓનલાઈન વાર્તાલાપોમાં કે અંગત બેઠકોમાં ય આવી ચઢે છે ને આપણી સેવાપ્રાગુલી કેટલી પ્રેક્ટિકલ છે તે બાબત આવી જ પૂછપરછો કરતા જેવા મળે છે. જે ઉત્સુકતા નહીં હોય તો બદલાવાની તૈયારી પાગ નહીં હોય ને તો પછી ઉપદેશ શામાટે આપવો?

શ્રીઆચાર્યચરાગ તેથી જ ખરેખરા અનુયાયીઓને વાગ્ણી-કાયા-મનથી વૃથા આલાપ-કિયા-ધ્યાન નો ત્યાગ કરવાથી શરૂ કરી ભજનમાં પ્રતિકૂલ પરિવારજનોનો ય ત્યાગ કરવાનો ઉપદેશ અહીં નિબન્ધમાં આપે છે. શ્રીદ્યારામભાઈ કહે છે: “જે હરિને ભજતાં વારે તેને તુરત ત્યજો”.

સ્ત્રીએ જ્લેવેસ્કી મુજબ સરેરાશ અમેરિકન વીક ડેઝમાં કામસર અને નકામા મળી રોજ ૧૧ કલાક સ્કીન સામે જેતાં ગાળે છે! જેનું ઓનલાઈન કામકાજ હોય તેની વાત અલગ છે પાગ અમસ્તા ય લોકો સ્કીનસામે ખોડાયેલા રહે છે! આપણે ભારતીયો ય જાગે આમાં ય અમેરિકનોથી બહુ પાછળ નથી રહી જવા માંગતા! તે મોબાઇલ ને ટી.વી. ને લેપટોપ ને કારમાનું સ્કીન મયડ્યા કરતા હોય છે જગ્યા ત્યારથી મોડી રાત સુધી ; લોકડાઉન ક્યારનું પતી ગયું પછી ય. પછી કહેવાનું કે સેવા રોજ કરવી પડતી હોય તો પ્રેક્ટિકલ નથી! તે લ્યા સ્કીનપર તો ન જ થાય ને સેવા કે લગનજીવન!

જે આગળ વધવાની ઉત્સુકતા હોય તો બદલાવું પડશે, નકામી પ્રવૃત્તિઓપર કાપ મૂકવો પડશે. હવે કોણો ક્યાં કાપ મૂકવો તે વ્યક્તિએ પોતે વર્કબાઉટ કરવું પડે ; ગુરુ તો દિશાનિર્દેશ કરે. શ્રીઆચાર્યચરાગ અહીં એટલી ધૂટ આપે છે કે રોજનું કમાઈને ખાનારા સર્વથા બેન્કબેલેન્સ ન ધરાવનારા પરિવારે પાગ રોજ ત્રાગ કલાક સેવા કરવી જોઈએ. તે સવારે કરો કે સવાર-સાંજ મળીને કરો ; કોઈ આગ્રહ નથી. પ્રવાસાદિમાં કે કટોકટીમાં સંજોગોવશાત્ કે ચન્દગ્રાહણાદિમાં તેમાં કામચલાઉ

ધોરાગે વધારો-ઘટાડો કે પહેલા-મોડા પાગ કરી શકાય છે.

### (પ), (૯) આઉટસોર્સ, ઓટોમેટ

જમાનાની સાથે સાથે ગૃહસેવામાં સગવડો વધતી જય છે તેમ તેમ ગૃહસેવામાં પાગ આપાગે ત્યાં પરિવર્તન આવે છે. પહેલાની માફક દીવા/ફાનસ કે ડાયે વીજવાના પંખા કે જળાશયોનું જળ ભરવું હવે જરૂરી નથી ; ઈલોક્ટિક લાઈટો-પંખા-વોટર સખાય પ્રયોગિત છે. રસોઈમાં ય દૂધ, તૈયાર ખાંડેલા મસાલા, તૈયાર લોટ, સૂક્ષ્મવાગી, વગેરે ઉપલબ્ધ છે. શુંગારમાં તૈયાર બાંધેલી પાગ આદિ મળી રહે છે. તો તેનો લાભ લઈ તેની બનાવટ કે પ્રાપ્તિ પાછળ લાગતો સમય બચાવી શકાય છે. ત્યાં સુધી કંઈ ઓદું નથી ; તે બચેલો સમય પ્રભુની સન્મુખ રહેવા વાપરીએ તો તો લેખે લાગે. પરંતુ બધું રેડીમેડ લાવી સેવા ઝટપટ આટોપી લઈએ ને વધુ સમય લૌકિકમાં રચ્યાપણ્યા રહીએ તો બગવદ્ભાવ વધે શી રીતે? નેથી અહીં નિબન્ધમાં શ્રીઆચાર્યચરાગ આજા કરે છે : “સ્વયં પરિયરેદ્ ભક્તયા વસ્ત્રપ્રકાલનાદિભિ : ”. વસ્ત્રો ધોવા જેવી બહિરંગતમ સેવા પાગ જાતે કરો. તે ય પાછી ભક્તિથી ; વેઠ ઉતારતા હો તેમ નહીં. પિયરથી લાવેલી સો નોકરાગી હોવા છનાં દામોદરદાસ સંભરસ્વાલાના પત્ની બગવસેવાસંબંધી કાર્યો જાતે કરતા ; નોકરાગીઓથી ધરના બીજ કામો કરાવતા. કાશીના શેઠ પુરુષોત્તમદાસ ક્રોડપણ હોવા છનાં ગાયોનો તબેલો જાતે સાફ્ કરતા.

તો આ આઉટસોર્સિંગ અને ઓટોમેટ કરવામાં પ્રમાગભાન રાખવું અનિવાર્ય છે. ભાડૂતી સેવા લેવા કે આપવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે સિધ્યાનતમુજનાવલીમાં. જાતે કરવામાં સારી ગુગવત્તા નહીં મળે એવી લઘુતાગ્રન્થિ રાખવાની પાગ કોઈ જરૂર નથી ; પરિવારના અન્ય સભ્યો તમારું કરેલું ચલાવી લે છે તેમ શ્રીઠાકોરજ પાગ વાંધો નહીં લે. લગનમાં કેટરર કે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને રાખો તો ચાલે પાગ ત્યારબાના લગનજીવનમાં તે આવશ્યક નથી. કીર્તનના રેકોર્ડિંગ કે સામગ્રી / શુંગાર બનાવવાની વિડિયો ક્લિપો માંથી શીખીને જાતે કરવા ઉદ્યત થાઓ.

### (૭) ટેસ્ટ

શ્રીઆચાર્યચરાગ અહીં નિબન્ધમાં આજા કરે છે : “યથા યથા

હરિઃ કૃષુગઃ મનસિ આવિશાંતે નિજે, તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધને ”. સેવા-કથા કરતાં કરતાં તે વધારે જેમથી ઉદ્ઘાસથી કરવાની નિષ્ઠા વધતી જય તો સમજવું કે ધીરે ધીરે તમારા મનમાં પ્રભુનો આવેશ થઈ રહ્યો છે. તેથી વિપરીત કંટાળો આવવા મંડે કે બોજાર્દ્ય અથવા ત્રાસર્દ્ય લાગવા મંડે તો સમજવું કે ઊંઘી દિશામાં પ્રગતિ થઈ રહી છે. તો આ સરળ ચકાસણી સતત કરતાં રહેવાથી દિશાભાન બનેલું રહે છે.

### (૮) સ્ટાર્ટ યોર એન્જિન

અન્યાગ્રહવશાત્, ભગવદ્ભાવને સ્વીચ્છાઓફ કરવાનું પાણ કરાગ બની જતી અપરસ અસલમાં આપાગે ત્યાંની સ્ટાર્ટ કરવાની પ્રવૃત્તિ છે. સ્નાન કરી ચરાગામુન લઈ ભગવદ્ભામ લઈ શ્રીયમુનાજ અને શ્રીઆચાર્યચરાગુનું સ્મરાગ કરી કાયા-વાગી-મનની શુદ્ધિ સંપાદન કરી સેવાનો આરંભ કરવાની શિસ્ત કેળવતાં ભગવત્સેવામાં વિધો કે બાધાઓ આવવાની શક્યતા ધરી જય છે. તેમ જ નિય કથામાં પાણ હાથ-પગ ધોઈ મૌન રાખી જમીનપર આસન પાથરી બેસી પુસ્તકને માથે ચઢાવી ભગવદ્ભસ્મરાગ કર્યા બાદ વાંચન કે શ્રવાગનો ગ્રારંભ કરવાની પરંપરા છે.

ઝેર. આ તો થથો સમાંતર ઉપદેશ. તે સિવાય કેટલોક આગવો ઉપદેશ પાણ મહાત્વપૂર્ણ છે, જેને હવે જોઈએ.

### (૯) દફવિશવાસ

દરદીના ગંભીર કિસ્સાઓની વાત અલગ છે પાણ આજકાલ મેડિકલ સાયન્સમાં સચોટ નિદાનપર વિશ્વાસના અભાવમાં મામૂલી રોગોમાં ય જતજતના ટેસ્ટ કરાવવામાં સમય-પૈસા-શક્તિની બેહિસાબ બરબાદી થાય છે ને બિમારી ત્યાં સુધીમાં વકરી જય છે. નિદાન થઈ જય ત્યારે હાથમાં ન સમય બચ્યો હોય છે ન પૈસા ન દરદીમાં શક્તિ! પાછો વળી બીજો અભિપ્રાય લો તો નવેસરથી મૂંડાવાનું.

વિશ્વાસનો અભાવ આપાગને દરિદ્ર બનાવ્યે જ ધૂટકો કરે છે. બે-ત્રાગ વીમાની ને મેડિકલેઈમની પોલિસીઓ લઈને ય લોકો ભયથી ફંડડના રહેતા હોય છે. આનો શું ઈલાજ? શ્રીઆચાર્યચરાગ પ્રભુમાં

દદવિશ્વાસ રાખવાનું કહે છે.

અશરકું ડબાવાલાનો થેર છે :

મેળ્યારે ખાતરી-શંકા-અનુમાનો ત્યજ દીધા,

હતો જે લાપતા તેના સગડનો રાફ્ટો ફાટ્યો.

એક ઘરના શ્રીદકોરજીના ચરાગુને પકડી રાખો તો ભટકવામાં સમય નહીં વેદ્ધાય. ને જે અન્યાન્ય કરતા જ ગયા તો છેડો જ નહીં આવે.

### (૧૦) અર્થોપાર્જનમાં યુક્તિ

સંતદાસની વાત્તીમાં આવે છે : “પાછે ચોબીસ ટકાકી પૂણું રહી. તાકો લે કોરી સેઉકે બજારમે બેચન લાગે. સો ક્રીડિનકી ઢેરી પૈસા પૈસાકી ન્યારી ન્યારી કરિકે ધરતે. આપ કાહૂંતે બોલતે નાહી. લોગ પૈસા ધરિકે કોરીકી ઢેરી લે જાતે. સો અફાઈ પૈસા નિત્ય કમાતે. આપ બેઠે પોથી દેખતે”.

આવો જ એક તાજેતરનો કિસ્સો સાંભળ્યો છે. એક આપાગુા વૈષ્ણવ ભાઈ રોજ રાતે મોટા તપેલામાં બટાટાની સૂકીભાજી રાંધીને મૂકી દે છે અને પોતે ચૂપવાપ ધાર્મિક સાહિત્ય વાંચતા રહે છે. રાજકોટના રાત્રિની પાળીના સોની કારીગરો આવીને સેલ્ફસવિસથી પોતાના જેટલું લઈને પૈસા મૂકી જતા રહે છે.

માંલ કે સુપરમાર્કેટમાં પાણું આજકાલ માલ જોખીને તૈયાર પેકેટો બનાવીને કિમત છાપીને ગોઠવેલા હોય છે. ગ્રાહક જાતે ઊંચકીને પૈસા ચૂક્યીને લઈ લે છે.

આવી સાયલન્ટ સેલિંગ જેવી યુક્તિથી ફાજલ સમય મળી રહે છે, જે ભગવદ્ભાવને વૃદ્ધિંગત કરવા કામે લગાડી શકાય છે અર્થોપાર્જન કરતાં કરતાં. તેથી શ્રીઆર્�થ્યરાગ ઉપદેશ આપે છે કે બને તો જે યુક્તિથી અર્થોપાર્જન અને ભગવદ્ભાવનુસંધાન બન્ને સધાય તેવું આચરાગ કરો.

### (૧૧) વૈરાગ્ય, પરિતોષ, નિરપેક્ષતા, ભાવનાપૂર્વક સહન કરવું

બાધ્ય ઉપાયોને બાદ કરતાં આપાગું મન અવ્યાકુળ રહે તે માટે શ્રીઆર્�થ્યરાગ અહીં નિબન્ધમાં તથા વિવેકધીર્યશ્રયમાં વિસ્તારથી ઉપદેશ આપે છે ; અહીં ઉલ્લેખમાત્ર કરું છું.

વैરाग्य કેળવતાં મોજશોખની પાઇળ સમય-પૈસા-શક્તિ વેડફાના નથી. સંતોષથી રહીએ તો કોઈ સુવર્ગમૃગને પ્રાભ કરવાની ઘેલણા થતી નથી. કોઈથી કાંઈ અપેક્ષા રાખીએ ને તે પૂરી ન થાય ત્યારે નિરાશ થઈ માનસિક ઉદ્દેગ પેદા કરી સમય ગુમાવીએ તેના કરતાં નિરપેક્ષ થઈને રહેવામાં ફાયદો છે. ત્રિવિધ દુઃખોને સહન કરતાં આહી બતાવેલ વિવિધ ભાવનાઓ કરી લેવાથી મન વિચલિત નથી થતું.

ઉપદેશ સિવાય ભગવદીયોના ચરિત્રોમાંથી ય કાંઈક હવે શીખીએ.

(૧૨) સામાજિક પ્રતિકા કે આમન્યા ની દરકાર ન કરવી

શેઠ પુરુષોત્તમદાસ રાત્રે બીજ વૈષ્ણવને ત્યાં સત્સંગ કરવા જાતે ચાલીને જતા. વળી કાશીના રાજ તેમને મળવા તેમના ઘરે આવ્યા તો તબેલો સાછ કરતા હતા તેવા જ વેશે તેઓ સામા ગયા. દામોદરદાસ સંભરવાલા ઘોડાપર બેસી રાજદરભારમાં કામકાજ કરવા જતા પરંતુ જલની ગાગર ભરવા પગપાળા જતા, સસરાની આમન્યાની દરકાર કર્યા વિના. રામદાસ સારસ્વત સિપાહીવેશે રસ્તાપરનો ખાડો પૂરવા મચ્યી પડ્યા, જે માર્ગ શ્રીઆચાર્યચરાગ પથારતા.

અને એક આપણે સમાજમાં પોતાનું સ્ટેટ્સ બનાવવા ને જળવવામાંથી ઊંચા નથી આવતા. પછી કહીએ કે સમય નથી મળતો! એ તો કાઢવો પડે ભાઈ આ વૈષ્ણવોની માફક. ઘરમાં લગ્ન લીધા હોય તો તૈયાર થવાનો ને ડાન્સ પ્રેક્ટિસનો ય સમય મળી રહે છે! છે ને કુમાલ!

ઐર. આ બધું કરી સમય ફાળવીએ તો હવે સંવેદના જળવાઈ રહે અને વધે તેવા નુસખા વિચારીએ.

(૧૩) તદાક્ષ્ય-તદીયત્વબુધ્યથી કિંચિત્ સમાચારાગ

નારાયાગદાસ કાયસ્થ રાજદરભારના કામકાજમાં વયસ્ત રહેતા હોવાથી ઘડી ઘડી શ્રીગોકુલ અને શ્રીઆચાર્યચરાગનું સ્મરાગ કરાવવા એક ચાકર રાખેલો. બાંસવાડાના ગોપાલદાસને ગામમાં કોઈ સત્સંગ ન મળતો હોવાથી તેમણે યાત્રાના માર્ગપર એક વિશ્રામસ્થળ બનાવ્યું, જ્યાં કોઈ પ્રવાસી વૈષ્ણવોનો મિલાપ થઈ જતો. આવા ન ઉપદેશોલા પોતે

શોધી કાઢેલા નુસખાઓથી ભગવત્સમરાગ નિભાવી શકાય છે.

આજકાલ ખાસ કરીને દુકાનદારો ને દ્રોઈવરો ઘરાડી ઓછી હોય ત્યારે ભજનો કે પ્રવચનો વગાડે છે કે નિયમિત પ્રવાસીઓ મોબાઇલપર ડાઉનલોડ કરી વાંચે છે તે પણ આવા જ નુસખા છે. મન તેમાં રહે તો તે કારગર નીવડે છે.

(૧૪) આવશ્યક કામકાજ છોડીને ઘરે રહી ઉત્સવો શ્રીઠાકોરજસંગે ઉજવવા

શ્રીનંદ્રાયજીએ કુસને કર ચૂકવવા મથુરા જવાનું મોક્ષફિ રાખી પહેલા ગોકુલમાં રહી જન્મોત્સવ ઉજવ્યો. હરિવંશ પાઠક પટનાથી મારતે ઘોડે ઘરે કાશી આવ્યા ને દોલોત્સવ ઉજવ્યો. તો વીક ડેમાં આવતી પોતાની બથડ એનારાએદ વીકઅન્ડમાં ભલે ઉજવી લે પણ સેવાસંબંધી ઉત્સવોને ટોચનો અગ્રતાક્રમ આપવો જોઈએ ; ઢાલા વચ્ચનમાં નહીં પણ આચરાગમાં ય.

(૧૫) નિશ્ચિંતનાનો અભાવ

કારકીર્દ અને મોજમજમાં વસ્ત ધનિક મા-બાપો સંતાનોને બહારગામ મોધી રેસિડેન્ટ બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરાવી નિશ્ચિંત તો થઈ જાય છે પણ સંવેદનશીલ નથી રહી જતા. ભક્તસેવકની આવી દૂર્જિત ન થાય તે માટે મોટે ભાગે શ્રીઠાકોરજ તેને બહુ આર્થિક સમૃદ્ધિ નથી આપતા. વળી એક ક્ષત્રગાણી બહુ દિવસના લાડુની સામગ્રી એકસાથે બનાવી એક હાંડીમાં ભરી નિશ્ચિંત થઈને બેઠી તો શ્રીઠાકોરજએ સ્વયં હાંડી ઉતારી ને બધા લાડુ એક જ વખતે આરોગ્યા. વાર્તાના ભાવપ્રકાશકારના મતે મન લાગેલું રહે તે માટે નિત્ય એવું ચિંતન થતું રહેવું આવશ્યક છે કે આજે સેવામાં શું સિદ્ધ કરવાનું છે. તેથી શક્ય હોય ત્યાં સુધી નિત્ય નૌતન તાજ રસોઈની સામગ્રી, વિવિધ શુંગાર વગેરે કરવા પ્રયત્ન કરવો. ક્યારેક બીજા વૈષ્ણવને ત્યાં કોઈક કારાગસર થોડા સમય માટે શ્રીઠાકોરજ પધરાવ્યા હોય તો ય નિશ્ચિંત ન થઈ જવું પણ રામદાસ સાંચોરાની માફક સંવેદનશીલ રહેવું.

(૧૬) સગવડ હોય ત્યારે સરખી સેવા કરી લેવી

વહુધેલા કે પુત્રધેલા પુરુષને વડીલો ટપારતા હોય છે કે બૈરી-છોકરાને બહુ માથે ન ચઢાવ નહીં તો ભવિષ્યમાં ભારે પડશે. કેટલેક અંશે

આ સાચું ય હોઈ શકે. પાગ એક વાતે એ ય સમજવી રહી કે પરિવારમાટે સમય કાઢવો એ વય ન હોઈને રોકાગુ હોય છે ; ક્યારેક એ ઊગી નીકળે છે. “ભવિષ્યમાં આટલી કસરત નહીં થાય તો ?” એમ વિચારી કોઈ કસરતબાજ હાલમાં કસરત કરવાનું ઓછું નથી કરી દેતો. ભાવપ્રકાશકારના મતે હાલ સેવા જેમથી ઉલ્લાસથી કસર રાખ્યા વિના કરશો ને ભવિષ્યમાં તેટલી નહીં થાય તો ન્રિપુરદાસ કાયસ્થની માફક તાપ થશે ; જે ભગવદ્ભાવને બળવત્તર બનાવશે ને પ્રભુ પાગ એક પરિવારજનની માફક તેનો સવળો પ્રતિભાવ આપશે. પાગ પહેલેથી જ ભવિષ્યના તરે સેવાનો પ્રકાર સૂક્ષ્મ કરી નાખશો તો ભવિષ્યમાં ઘટવાથી થતો તાપ ક્યાંથી થશે ? તો ભવિષ્યમાં પડશે એવા દેવાશે એવો અભિગમ રાખી અત્યારનો દૂર્વિભ અવસર જતો ન કરવો.

### (૧૭) સેવારે વહેલા ઊઠવું

જે પરિવારજનો કે પાડોશીઓને ત્રાસ ન થતો હોય ને કલહનું કારગુ ન બનતું હોય તો સેવારે વહેલા ઊઠીને પ્રભાતે શાંત પરિસરમાં એકાંતમાં સેવા કરતાં કાયા-વાગી-મન આપોઆપ સહકાર આપે છે. અનેક વૈષ્ણવો તેમ કરતાં અને કરે ય છે.

### (૧૮) સેવા કરતાં મન દેકાગુ રાખવું

નારાયાગદાસ બ્રહ્મચારી સેવા કરતાં શ્રીઆચાર્યજીના પધાર્યાની વધાઈ સાંભળી ગરમ સામગ્રી ભોગ ધરી સામા ગયા તો શ્રીઠકોરજીને પરિશ્રમ થયો. તેથી સેવા કરતી ઘડીએ મન સેવા સિવાયની લોકિક કે અલોકિક બાબનોમાં ન પરોવવું ; સેવાને જ ટોચનો અગ્રતાકમ આપવો. અનવસરમાં બીજ કાર્યક્રમો આટોપી લેવા.

### (૧૯) સેવાસ્થળને સુશોભિત રાખવું

બને લ્યાં સુધી સેવાસ્થળને તેના મોભાને અનુરૂપ રાખવું ; તેના શ્રી-ઈન-વન કે ટૂ-ઈન-વન જેવા અન્ય ઉપયોગો ન કરવા. તેવા સુશોભિત સ્થળો પ્રભુને પધરાવી સપ્રેમ શાગગારવાનો આનંદ માગવાનો શ્રીઆચાર્યરાગ અહીં નિબન્ધમાં ઉપદેશ આપે છે.

(૨૦) ઉધાર પૈસા કે સામગ્રી લઈ સેવા ન કરવી

સામાન્ય રીતે ભક્તિમાર્ગી જડી ચામડીના ન હોવાના. તે જે ઉધાર લે તો ચિત્ત ભગવાનને ઢેકાગું કરજ ચૂકવવાના ઉપાયો શોધવામાં રમમાગું થઈ જાય. વળી ન કરે નારાયાગું ને મૃત્યુ થાય તો જીવની અવગતિ થાય. તેથી અનેક વાર્તાપ્રસંગોમાં ભાવપ્રકાશકાર ને આંક તો સ્વયં શ્રીઠાકોરજ પાગું ઉધારીનો નિર્ણેય કરી હોય તેટલાથી સેવા કરવાનો જ આગ્રહ રાખે છે.

જેનાથી ભક્તિમાર્ગપર ન ચાલી શકાય તેને માટે શ્રીઆચાર્યચરાગું શરાગુમાર્ગનો ઉપદેશ આપે છે. પાગું ત્યાંય સમય વેડફ્લવાનો તો નથી જ. બળદના શિંગડાપર રાઈનો દાગું ટકે તેટલી વાર પાગું ભગવદનુસંધાન છૂટ્યું તો આસુરાવેશ થવાનો. તેથી બને તેટલા કાયા-વાગું-મનથી વિવેક-ધૈર્ય-આશ્રય કાયમ રાખવાના છે. કમસે કમ સારા-નરસા કામો કરતા કરતા ય શરાગુભાવવનાનું અનુસંધાન કાયમ રાખવાનું છે. અસુરો હવનમાં હાડકા નાખી યક્ષભંગ કરી દેતા તેમ આસુરાવેશનો હવન કરતી ઘડીએ તેવું અનુસંધાન રાખતાં ત્રિક્ષાગુાવસ્થાયી મન પાછું ભગવદાવિષ્ટ થઈ શકે છે.

“નિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીજ’,  
એક તો ઓછી મદિરા છે ને ગળતો જામ છે !”

અંતે આમાંનું કોને કેટલું માફક આવે કે ન આવે તેની ચિંતા કર્યા વિના દામોદરદાસજીના વાર્તાપ્રસંગમાંથી આટલું કહી વિરામ લઈશ : “હમકો રાજકો એક બેર બિનતી કરની સો કરી. પાછે આપ પ્રભુ હો ; ભલી જાનોગે સો કરોગે. પરિ યહ મારગ તો યા ભાંતિકો હે.”

॥ બુધિપ્રેરકકૃષ્ણગુસ્ય પાદપત્રં પ્રસીદ્તु ॥